

©



सत्यमव जयते

# The Gujarat Government Gazette

## PUBLISHED BY AUTHORITY

VOL. LXIII ]

THURSDAY, APRIL 14, 2022 / CHAITRA 24, 1944

[ No. 15

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

### PART IV-B

**Rules and Orders (Other than those published in Part I, I-A and I-L) made  
by the Government of Gujarat under the Gujarat Acts.**

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ  
જાહેરનામુંઅધિસૂચના  
સચિવાલય, ગાંધીનગર, પદ્મી માર્ચ, ૨૦૨૨

ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧.

ક્રમાંક: જીએચેકેઅચ-૨૮-૨૦૨૨-પરચ-૧૦૨૦૨૦-૧૭૮-ખ: ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૬૧ થી પ્રાપ્ત થયેલ સત્તાધિકારની રૂએ, આથી ધી બગસરા વિભાગીય શાકભાજી ઉત્પાદક સહકારી મંડળી લી. (ફડચામાં), તા.બગસરા, જિ.અમરેલીને આ અધિનિયમની કલમ-૧૧૪(૧)ની જોગવાઈના અમલમાંથી તા.૦૬-૦૫-૨૦૧૮ થી તા.૦૫-૦૫-૨૦૨૨ સુધી મુક્તિ આપવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

જી. બી. તદવી,  
સરકારના ઉપસચિવ.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ  
જાહેરનામું

સચિવાલય, ગાંધીનગર, ૨૮મી માર્ચ, ૨૦૨૨

નં. જીએચેકેઅચ-૪૦-૨૦૨૨-નસબ-૧૧-૨૦૧૪-૮૨-ચ: ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૦૭ દેટા મળેલ સત્તા અન્વયે રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા.૦૨/૦૨/૨૦૦૭ના હુકમ ક્રમાંક નસબ/૦૧/૩-૧૦/૩૫૭/૦૭થી ધી ચાજકોટ મહિલા નાગરિક સહકારી બેંક લી., રાજકોટને ફડચામાં લઈ જવામાં આવેલ. ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧)ની જોગવાઈ મુજબ ફડચાના હુકમથી ત્રણ વર્ષમાં ફડચાની કાર્યવાહી આટોપી લેવાની રહે છે. ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧) દેટા મળેલ સત્તા અન્વયે સદરહુ સંસ્થાની ફડચાની મુદ્દત રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય ગાંધીનગરના

વખતોવખતના હુકમોથી તા.૦૧/૦૨/૨૦૧૪ સુધી વધારવામાં આવેલ હતી. પરંતુ સદરહુ મુદ્દત વધારા દરમ્યાન ફડ્યાની કાર્યવાહી આટોપી શકાયેલ ન હતી. ત્યારબાદ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૬૧ હેઠળ મળેલ સત્તા અન્વયે રાજ્ય સરકારના કૃપિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના વખતોવખતના જાહેરનામાથી તા.૦૧/૦૨/૨૦૨૨ સુધી કલમ ૧૬૧ હેઠળ મુક્તિ આપવામાં આવેલ હતી. પરંતુ સદરહુ સમયગાળા દરમ્યાન ફડ્યાની કાર્યવાહી આટોપી શકાયેલ નથી.

ધી રાજકોટ મહિલા નાગરિક સહકારી બેંક લી., રાજકોટને ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૬૧ હેઠળ મળેલ સત્તાની રૂએ કલમ-૧૧૪(૧)ની જોગવાઈઓના અમલમાંથી તા.૦૨/૦૨/૨૦૨૨ થી તા.૦૧/૦૨/૨૦૨૩ સુધી મુક્તિ આપવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

સિમતા અધ્યર્થ,  
સરકારના ઉપસચિવ.

### કૃપિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ

#### જાહેરનામું

સચિવાલય, ગાંધીનગર, ૨૮મી માર્ચ, ૨૦૨૨

નં. જીએચેકેએચ-૪૧-૨૦૨૨-નસબ-૧૧-૨૦૧૮-૧૧૧-૪: ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૦૭ હેઠળ મળેલ સત્તા અન્વયે રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગાંધીનગરના તા.૦૩/૦૨/૨૦૧૧ના હુકમ ક્રમાંક: નસબ/ફડ્ય/જ-૧૦/૫૩૭/૨૦૧૧થી ધી સિધ્ધપુર નાગરીક સહકારી બેંક લી.(ફડ્યામાં), સિધ્ધપુર, જિ.પાટડાને ફડ્યામાં લઈ જવામાં આવેલ. ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧)ની જોગવાઈ મુજબ ફડ્યાના હુકમથી ત્રણ વર્ષમાં ફડ્યાની કાર્યવાહી આટોપી લેવાની રહે છે. ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧) હેઠળ મળેલ સત્તા અન્વયે સદરહુ સંસ્થાની ફડ્યાની મુદ્દત રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય ગાંધીનગરના વખતોવખતના હુકમોથી તા.૦૨/૦૨/૨૦૧૮ સુધી વધારવામાં આવેલ હતી. પરંતુ સદરહુ મુદ્દત વધારા દરમ્યાન ફડ્યાની કાર્યવાહી આટોપી શકાયેલ ન હતી. ત્યારબાદ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૬૧ હેઠળ મળેલ સત્તા અન્વયે રાજ્ય સરકારના કૃપિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના વખતોવખતના જાહેરનામાથી તા.૦૨/૦૨/૨૦૨૨ સુધી કલમ-૧૬૧ હેઠળ મુક્તિ આપવામાં આવેલ હતી. પરંતુ સદરહુ સમયગાળા દરમ્યાન ફડ્યાની કાર્યવાહી આટોપી શકાયેલ નથી.

ધી સિધ્ધપુર નાગરીક સહકારી બેંક લી.(ફડ્યામાં), સિધ્ધપુર, જિ.પાટડાને ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૬૧ હેઠળ મળેલ સત્તાની રૂએ કલમ-૧૧૪(૧)ની જોગવાઈઓના અમલમાંથી તા.૦૩/૦૨/૨૦૨૨ થી તા.૦૨/૦૨/૨૦૨૩ સુધી મુક્તિ આપવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

સિમતા અધ્યર્થ,  
સરકારના ઉપસચિવ.

### કૃપિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ

#### જાહેરનામું

સચિવાલય, ગાંધીનગર, ૨૮મી માર્ચ, ૨૦૨૨

નં. જીએચેકેએચ-૪૨-૨૦૨૨-સમબ-૧૨-૨૦૦૮-૨૭૩૭-૪: ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૦૭ હેઠળ મળેલ સત્તા અન્વયે રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા.૦૩/૦૧/૨૦૦૨ના હુકમ ક્રમાંક: નસબ/૦૧/જ-૧/૨૨/૨૦૦૨થી ધી અમદાવાદ અર્બન કો.ઓ. બેંક લી., અમદાવાદને ફડ્યામાં લઈ જવામાં આવેલ. ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧)ની જોગવાઈ મુજબ ફડ્યાના હુકમથી ત્રણ વર્ષમાં ફડ્યાની કાર્યવાહી આટોપી લેવાની રહે છે. ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧) હેઠળ મળેલ સત્તા અન્વયે સદરહુ સંસ્થાની ફડ્યાની મુદ્દત રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય ગાંધીનગરના વખતોવખતના હુકમોથી તા.૦૨/૦૧/૨૦૦૮ સુધી વધારવામાં આવેલ હતી. પરંતુ સદરહુ મુદ્દત વધારા દરમ્યાન ફડ્યાની કાર્યવાહી આટોપી શકાયેલ ન હતી. ત્યારબાદ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૬૧ હેઠળ મળેલ સત્તા અન્વયે રાજ્ય સરકારના કૃપિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના વખતોવખતના જાહેરનામાથી તા.૦૧/૦૧/૨૦૨૨ સુધી કલમ ૧૬૧ હેઠળ મુક્તિ આપવામાં આવેલ હતી. પરંતુ સદરહુ સમયગાળા દરમ્યાન ફડ્યાની કાર્યવાહી આટોપી શકાયેલ નથી.

ધી અમદાવાદ અર્બન કો. ઓ. બેંક લી., અમદાવાદને ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૬૧ હેઠળ મળેલ સત્તાની રૂએ કલમ-૧૧૪(૧)ની જોગવાઈઓના અમલમાંથી તા.૦૨/૦૧/૨૦૨૨ થી તા.૦૧/૦૧/૨૦૨૩ સુધી સમયસર કામગીરી પૂર્ણ કરવા મુક્તિ આપવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

સિમતા અધ્યર્થુ,  
સરકારના ઉપસચિવ.

### કૃપિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ

જાહેરનામું

સચિવાલય, ગાંધીનગર, ૨૮મી માર્ચ, ૨૦૨૨

નં. જીએચેકેઅચે-૪૩-૨૦૨૨-નસબ-૧૧-૨૦૦૮-૩૧૬-ચ: ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૦૭ હેઠળ મળેલ સત્તા અન્વયે રજિસ્ટ્રારશી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા.૦૫/૦૨/૨૦૦૧ના હુકમ ક્રમાંક: નસબ/ફડચ/૧૮૮/૫-૧/૨૨૮/૨૦૦૧થી શ્રી વેરાવળ વિભાગીય નાગરિક સહકારી બેંક લી., વેરાવળને ફડચામાં લઈ જવામાં આવેલ. ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧)ની જોગવાઈ મુજબ ફડચાના હુકમથી ત્રણ વર્ષમાં ફડચાની કાર્યવાહી આટોપી લેવાની રહે છે. ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧) હેઠળ મળેલ સત્તા અન્વયે સદરહુ સંસ્થાની ફડચાની મુદ્દત રજિસ્ટ્રારશી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના વખતોવખતના હુકમોથી તા.૩૧/૦૩/૨૦૦૮ સુધી વધારવામાં આવેલ હતી. પરંતુ સદરહુ મુદ્દત વધારા દરમ્યાન ફડચાની કાર્યવાહી આટોપી શકાયેલ ન હતી. ત્યારબાદ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૬૧ હેઠળ મળેલ સત્તા અન્વયે રાજ્ય સરકારના કૃપિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના વખતોવખતના જાહેરનામાથી તા.૩૧/૦૩/૨૦૨૨ સુધી કલમ ૧૬૧ હેઠળ મુક્તિ આપવામાં આવેલ હતી. પરંતુ સદરહુ સમયગાળા દરમ્યાન ફડચાની કાર્યવાહી આટોપી શકાયેલ નથી.

શ્રી વેરાવળ વિભાગીય નાગરિક સહકારી બેંક લી., વેરાવળને ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૬૧ હેઠળ મળેલ સત્તાની રૂએ કલમ-૧૧૪(૧)ની જોગવાઈઓના અમલમાંથી તા.૦૧/૦૪/૨૦૨૨ થી તા.૩૧/૦૩/૨૦૨૩ સુધી મુક્તિ આપવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

સિમતા અધ્યર્થુ,  
સરકારના ઉપસચિવ.

### કૃપિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ

જાહેરનામું

સચિવાલય, ગાંધીનગર, ૨૮મી માર્ચ, ૨૦૨૨

નં. જીએચેકેઅચે-૪૪-૨૦૨૨-નસબ-૧૧-૨૦૧૭-૧૬૦૮-ચ: ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૦૭ હેઠળ મળેલ સત્તા અન્વયે રજિસ્ટ્રારશી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા.૦૧/૦૧/૨૦૧૦ના હુકમ ક્રમાંક: નસબ/ફડચ/૫-૪/૧/૧૦૩૦ ધી કેમ્બે છિન્હુ મરચન્ટ કો.ઓ. બેંક લી.(ફડચામાં) ખંભાતને ફડચામાં લઈ જવામાં આવેલ. ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧)ની જોગવાઈ મુજબ ફડચાના હુકમથી ત્રણ વર્ષમાં ફડચાની કાર્યવાહી આટોપી લેવાની રહે છે. ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧) હેઠળ મળેલ સત્તા અન્વયે સદરહુ સંસ્થાની ફડચાની મુદ્દત રજિસ્ટ્રારશી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના વખતોવખતના હુકમથી તા.૩૧/૧૨/૨૦૧૭ સુધી વધારવામાં આવેલ હતી. પરંતુ સદરહુ મુદ્દત વધારા દરમ્યાન ફડચાની કાર્યવાહી આટોપી શકાયેલ ન હતી. ત્યારબાદ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૬૧ હેઠળ મળેલ સત્તા અન્વયે રાજ્ય સરકારના કૃપિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના વખતોવખતના જાહેરનામાથી તા.૩૧/૧૨/૨૦૨૧ સુધી કલમ ૧૬૧ હેઠળ મુક્તિ આપવામાં આવેલ હતી. પરંતુ સદરહુ સમયગાળા દરમ્યાન ફડચાની કાર્યવાહી આટોપી શકાયેલ નથી.

ધી કેમ્બે છિન્હુ મરચન્ટ કો.ઓ. બેંક લી.(ફડચામાં) ખંભાતને ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૬૧ હેઠળ મળેલ સત્તાની રૂએ કલમ-૧૧૪(૧)ની જોગવાઈઓના અમલમાંથી તા.૦૧/૦૧/૨૦૨૨ થી તા.૩૧/૧૨/૨૦૨૨ સુધી મુક્તિ આપવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

સિમતા અધ્યર્થુ,  
સરકારના ઉપસચિવ.

**કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ**

જાહેરનામું

સચિવાલય, ગાંધીનગર, ૨૮મી માર્ચ, ૨૦૨૨

**નં. જાહેરનામું-૪૫-૨૦૨૨-નસબ-૧૧-૨૦૧૮-૨૭૮-થ:** ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૦૭ હેઠળ મળેલ સત્તા અન્વયે રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા.૨૬/૦૩/૨૦૧૦ના હુકમ કમાંક: નસબ/ફડચ/જ-૧૦/૧૩૮૭/૮૧૨/૨૦૧૦થી ધી બહાદરપુર અર્બન કો. ઓપ. બેંક લી., (ફડચામાં) બહાદરપુરને ફડચામાં લઈ જવામાં આવેલ. ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧)ની જોગવાઈ મુજબ ફડચાના હુકમથી ત્રણ વર્ષમાં ફડચાની કાર્યવાહી આટોપી લેવાની રહે છે. ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૧૪(૧) હેઠળ મળેલ સત્તા અન્વયે સદરહુ સંસ્થાની ફડચાની મુદત રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના વખતોવખતના હુકમથી તા.૨૬/૦૩/૨૦૧૮ સુધી વધારવામાં આવેલ હતી. પરંતુ સદરહુ મુદત વધારા દરમ્યાન ફડચાની કાર્યવાહી આટોપી શકાયેલ નથી. ત્યારબાદ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૬૧ હેઠળ મળેલ સત્તા અન્વયે રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના વખતોવખતના જાહેરનામાથી તા.૨૬/૦૩/૨૦૨૨ સુધી કલમ ૧૬૧ હેઠળ મુક્તિ આપવામાં આવેલ હતી. પરંતુ સદરહુ સમયગાળા દરમ્યાન ફડચાની કાર્યવાહી આટોપી શકાયેલ નથી.

ધી બહાદરપુર અર્બન કો. ઓપ. બેંક લી., (ફડચામાં) બહાદરપુરને ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ની કલમ-૧૬૧ હેઠળ મળેલ સત્તાની રૂએ કલમ-૧૧૪(૧)ની જોગવાઈઓના અમલમાંથી તા.૨૭/૦૩/૨૦૨૨ થી તા.૨૬/૦૩/૨૦૨૩ સુધી મુક્તિ આપવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

સિમતા અધ્યર્થુ,

સરકારના ઉપસચિવ.

### SOCIAL JUSTICE AND EMPOWERMENT DEPARTMENT

#### Notification

Sachivalaya, Gandhinagar, 31<sup>st</sup> March, 2022

#### GUJARAT (RIGHT OF CITIZENS TO PUBLIC SERVICES) ACT, 2013.

**No: GHL/01/2022/PRC/112021/455293/CH:** In exercise of the powers conferred by section 4 of the Gujarat (Right of Citizens to Public Services) Act, 2013 (Guj. 16 of 2013) and in supersession of the Government Notification, Social Justice and Empowerment Department No. GHL/2016/8/MIS/102016/105748/A, dated 22<sup>nd</sup> March, 2016 and No. GS/2016/AJK/102016/17575743/G, dated 30<sup>th</sup> March, 2016, the Government of Gujarat hereby notifies the following services as shown in column 2 of the Appendix, appended to this notification and the stipulated time limits within which such services shall be provided as specified in column 3 of the said Appendix.

#### Appendix

Sr. No.	The services declared under section 4 of the Act	Stipulated time limits
1	2	3
1.	Parixitlal Majmudar Pre.SSC Scholarship to SC students. Muni Metraj Scholarship for SC students whose parents are engaged in cleaning occupation (GOI). Post Metric Scholarship to SC students (GOI).	30 days
2.	Uniform assistance to SC Students (Std. 1 to 8)	30 days
3.	Sarasvati Sadhana Yojana Free Cycles to SC girls students (Std.IX) (As per availability of cycles)	30 days
4.	Maharaja Sayajirao Gayakvad M.phil & Ph.D Thesis assistance for SC students.	30 days
5.	Loan for Commercial Pilot for SC.	60 days
6.	Dr. Babasaheb Ambedkar Loan to SC students for higher Study in foreign Countries.	60 days

<b>Sr. No.</b>	<b>The services declared under section 4 of the Act</b>	<b>Stipulated time limits</b>
7.	Dr. P. G. Solanki Stipend for Lawyer, Dr. P. G. Solanki Loan/Subsidy Scheme for Lawyer for private practice, Dr. P. G. Solanki Loan/Subsidy Scheme for graduate & post graduate Doctors to open the clinic	30 days
8 .	Dr. Ambedkar Awas Yojna	30 days
9.	Kunvarbainu Mameru Yojna for SC girls	30 days
10.	Dr.Savitaben Ambedkar Inter Caste Marriage Assistance to SC.	30 days
11.	Nagrik cell	07 days
12.	Scholarship Scholarship for Developing Caste Students Studying in std. 1 to 8 Scholarship for Developing Caste Students Studying in Std. 9 to 10 Special scholarship for Most Backward Class Students studying in std. 1 to 10 Free Bicycle Under Sarasvati Sadhana Yojana to Girls student of developing caste studying in std.9 Uniform assistance for Developing Caste Students Studying in std. 1 to 8 Scholarship for Technical and Professional Courses Post S.S.C. Scholarship for the Girls Post S.S.C scholarship for Developing Caste Students Subsidy in Food Bill to students of Medical and Engineering. Assistance for Purchase of Instrument to Medical and Engineering Students Book Bank for Medical and Engineering Students	Approved in 30 days
13.	Financial Assistance For Kunvarbainu Mameru Scheme	30 days
14.	Financial Assistance for Sat Fera Samuh Lagna Yojna	30 days
15.	Loan for Commercial Pilot	60 days
16.	Loan for Higher Education in foreign Countries	60 days
17.	Scholarships for the courses like M.Phil And P.hd Students	30 days
18.	Special scholarship to Most Backward Class SC Students	30 days
19.	Pre SSC Scholarship for SC Students (Std.9 to 10) (GOI)	30 days
20.	State Government Post SSC Scholarship to SC girls students whose income is more than 2.50 lakh.	30 days
21.	Private Tuition Assistance to SC Students studying in Science/ Commerce stream (Std.11 to 12)	30 days
22.	Food Bill Assistance to SC students.	30 days
23.	Assistance to SC students for Purchase of Instrument (For Medical, Engineering and Diploma).	30 days
24.	Stipend to SC students for ITI and Professional Courses.	30 days
25.	Free Tablets For SC Students	30 days
26.	Kits Assistance under Manav Garima Yojana (Schedule Castes Welfare Directorate)	Approved in 30 days (As per availability of kits)

Sr. No.	The services declared under section 4 of the Act	Stipulated time limits
27.	Mai Ramabai Assistance for promoting group marriages	30 days
28.	Marnottar Sahay Yojna	30 days
29.	Kits Assistance under Manav Garima Yojana (Developing Castes Welfare Directorate)	Approved in 30 days (As per availability of kits)

By order and in the name of Governor of Gujarat,

**R. J. KHARADI,**  
Deputy Secretary to Government.

-----

